

આદર્શ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ગાંધીનગર ખાતે શરૂ કરવા  
માટે રૂ.૪૮,૩૬,૩૭૪/- ની વહીવટી મંજૂરી આપવા બાબત.

ગુજરાત સરકાર  
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ  
ઠરાવ ક્રમાંક: SJED/NIR/e-file/17/2023/3399/CHH Section  
સચિવાલય, ગાંધીનગર.  
તા. ૨૮ ૭ JUN 2024

#### વંચાએ લીધા:

(૧) નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી, ગાંધીનગરના તા. ૧૦/૧૧/૨૦૨૩ના પત્ર ક્રમાંક : DSD/NIT/e-file/226/2023/2279/planning branch

(૨) નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી, ગાંધીનગરના તા. ૧૫/૦૨/૨૦૨૪ના પત્ર ક્રમાંક : DSD/NIT/e-file/226/2023/2279/planning branch

#### પ્રસ્તાવના:

વંચાએ લીધેલા ક્રમાંક:(૧) પરના પત્રથી નિયામકશ્રી(સ.સુ.)એ આદર્શ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ગાંધીનગર ખાતે શરૂ કરવા રૂ.૪૮,૩૬,૩૭૪/- (અકે રૂપિયા અડતાભિસ લાખ ઓગણાચાલીસ હજાર ત્રણસો ચુમોતેર પુરા) નીનવી બાબત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ તરીકે જોગવાઈ કરવા દરખાસ્ત કરેલ હતી. વંચાએ લીધેલા ક્રમાંક:(૨) પરના નિયામકશ્રી, સમાજ સુરક્ષા, ગાંધીનગરના પત્રથી સદરહુ નવી બાબતની અંદાજપત્ર ૨૦૨૪-૨૫ માં જોગવાઈ થતાં સદરહુ બાબતને વહીવટી મંજૂરી આપવા બાબતની દરખાસ્ત કરેલ છે.

#### ઠરાવ:

પુષ્ટ વિચારણાના અંતે નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી, ગાંધીનગર હસ્તક ગાંધીનગર ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં પ૦ ની ટોચમર્યાદા ધરાવતું આદર્શ સરકારી ચિલ્ડ્રન હોમ શરૂ કરવા ( મિશન વાત્સલ્ય યોજના હેઠળ CSS-૫૦:૪૦) માટે નીચે મુજબની આઉટસોર્સની સેવાઓ(આપર્ટેક ખર્ચ) તથા વહીવટી+ બિનઆર્વર્ટક ખર્ચ૩.૦.૪૮/- કરોડની નવી બાબતને નીચે મુજબની શરતોને આધીન આધી વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

ક્રમ		સેવાની સંખ્યા	મહેનતાણું
૧	ઓફિસ સુપરિનેન્ડેટ (અધિકારી)	૧	૨૦૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૨	કાઉન્સિલર	૧	૨૦૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૩	પ્રોબેશન અધિકારી/બાળકત્વાણ અધિકારી/કેસ કર્મચારી	૧	૨૦૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૪	ગૃહમાતા અથવા ગૃહપતિ	૨	૧૫૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૫	પરામોક્કલ કર્મચારી	૧	૧૫૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૬	સ્ટોર-કીપર કમ હિસાબનીશ	૧	૧૯૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૭	શિક્ષક	૧	૧૫૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૮	હસ્તકલા-સહ- સંગીત શિક્ષક	૧	૧૫૦૦૦/- અન્ય ચાર્જીસ સિવાય
૯	વ્યાયામ પ્રશિક્ષક-સહ- યોગ પ્રશિક્ષક	૧	૧૫૦૦૦/-અન્ય ચાર્જીસ સિવાય
૧૦	રસોઈથા	૨	લઘુતમ વેતનની શરત અનુસાર
૧૧	સહાયક કમ રાત્રી ચોડીદાર	૨	લઘુતમ વેતનની શરત અનુસાર
૧૨	હાઉસકીપર	૧	લઘુતમ વેતનની શરત અનુસાર

#### શરતો:



૧. પ્રસ્તુત યોજના અંગેનો ખર્ચ તા.૦૧/૦૪/૨૦૨૪ પછી કરવાનો રહેશે.
૨. આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાં જ તેમજ અંદાજપત્રિય જોગવાઈની મર્યાદામાં જ સહાય ચુક્કવાની રહેશે. કોઈપણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકિય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામકશી, સમાજ સુરક્ષાએ રાખવાની રહેશે.
- ૩.આ યોજનાનો અમલ નિયામકશી,સમાજ સુરક્ષા ( નોડલ એજન્સી) મારફતે કરવાનો રહેશે.
૪. પારદર્શક પ્રક્રિયા અનુસરી લાભાર્થીની પસંદગી કરવાની રહેશે.
- ૫ ઓનલાઈન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રાવધાન રાખવાનું રહેશે.
૬. સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્નર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે. પરંતુ જે વસ્તુઓ GeM Portal પર ઉપલબ્ધ ન હોય એવી વસ્તુઓની ખરીદી માટે ઉધોગ અને ખાણ વિભાગના તા.૦૧/૧૦/૨૦૧૮ ના ઠરાવ મુજબ ઉધોગ અને ખાણ વિભાગ પાસેથી ના વાંધા પ્રમાણ પત્ર (No Objection Certificate) મેળવ્યા પછી જ ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ વખતો વખત થયેલ સુધારાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.સાધન/ કીટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે.
૭. નાણાકિય સહાય નિયત કરેલ સમયાંતરે DBT પદ્ધતિથી જ આપવાની રહેશે.
૮. આ યોજનાને DBT Portal ઉપર ફરજીયાત નોંધવાની રહેશે.
૯. C.M Dash Board સાથે યોજના Link કરવાની રહેશે.
૧૦. યોજનાના મોનિટરીંગની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
૧૧. Social Audit અને Third party Verification પણ સમયાંતરે કરાવી સરકારશ્રીને રજુ કરવાનું રહેશે.
૧૨. યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે.
૧૩. કેન્દ્ર સહાયિત યોજનામાં ફંડ કેન્દ્ર સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાર્થીને આપવાનો રહેશે.
૧૪. પ્રવર્તમાન યોજનાના નોંધ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે.
૧૫. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રિય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ચાંટની મર્યાદામાં કરવાનો રહેશે.
૧૬. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકિય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રિય જોગવાઈ કરાવી લેવાની રહેશે.
૧૭. આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે.
૧૮. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકિય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.
૧૯. આ મંજૂરી અન્વયે ફાળવેલ ચાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્કર કરવાની રહેશે.
૨૦. યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
૨૧. સદર વહીવટી મંજૂરી અન્વયે સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે.
૨૨. લઘુતમ વેતનન્દારા અધિનિયમ, ૧૯૪૮ અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના તા. ૨૭/૦૩/૨૦૨૩ના જાહેરનામા તથા તેને આનુષ્ઠાંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવો/પરિપત્રો દ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુતમ વેતન જેટલા જ મહેનતાણા આઉટસોર્સિંગ સ્ટાફને ચુક્કવાના રહેશે.
૨૩. આઉટ સોર્સથી સેવા વહીવટી મંજૂરી મુજબના સમયગાળા પૂરતી જ મેળવવાની રહેશે. તેના થી વધુ સમય માટે આ સેવા પૂર્વ મંજૂરી સ્થિર મંજૂરીની અપેક્ષાએ કે પાશ્ચાદવર્તી અસરથી મંજૂરી મેળવવાની અપેક્ષાએ કોઈપણ સંજોગોમાં ચાલુ રાખી શકાશે નહીં.



૨૪. આઉટ સોર્સથી સેવા લેવા અંગેની વહીવટી મંજુરી મળ્યા બાદ નિયત માન્ય આઉટસોર્સિંગ એજન્સી મારફત લેવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

૨૫. આઉટ સોર્સની જગ્યાઓની સેવાઓ માન્ય એજન્સી મારફત ૧૧ માસ માટે લેવાની રહેશે સેવાઓની મુદત પૂર્ણ થયેથી તાત્કાલિક અસરથી સેવાઓ સમાજ કરવાની રહેશે. ત્યાર બાદ જરૂર જણાયે નાણા વિભાગની પૂર્વ મંજુરી મેળવ્યા બાદ નિયત કાર્ય પદ્ધતિને અનુસરીને નવેસરથી સેવાઓ મેળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

૨૬. ડ્રાઇવર અને વર્ગ-૪ ની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧/૪/૨૦૧૦ ના છરાવની જોગવાઈ મુજબ મંજૂર થયેલ બજેટ જોગવાઈની મર્યાદામાં આઉટસોર્સિંગ કરાવવાની રહેશે.

૨૭. રાજ્ય સરકારની પ્રવર્તમાન આઉટસોર્સની નીતિનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. લઘુતમ વેતન ધારા, ઈપીએફ, ટીડીએસ, સર્વીસ ટેક્ષ, GST, સર્વિસ ચાર્જ અન્ય ચુકવણા અને કપાત સહિત લાગુ પડતા અધિનિયમો/કાયદાઓની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી સેવાઓ મેળવવાની રહેશે. વેતન અને સેવાઓ અંગે કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે જોવાની જવાબદારી નિયામકશ્રી, સમાજ સુરક્ષા કચેરીની રહેશે.

૨૮. એજન્સી દ્વારા નિયમિત મહેનતાણું નિયત થયા મુજબ પુરેપુર ચુકવે તે અંગે નિયામકશ્રી, સમાજ સુરક્ષા એ યોગ્ય મોનીટરિંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. તેમજ એજન્સી આ બાબતે ક્ષતિ કરે તો તેના પર યોગ્ય પગલા લેવાની જવાબદારી નિયામકશ્રી, સમાજ સુરક્ષા કચેરીની રહેશે.

૨૯. મહેનતાણાના દરે કેંદ્રીય યોજના હેઠળ નિયત થયેલ હોય કે સેવા સંબંધિત વિભાગના પરામર્શમાં નિયત કરી તેના આધારો સાથે નાણા વિભાગની પૂર્વ મંજુરી મેળવી ચુકવવાના રહેશે. તેમજ નાણા વિભાગની પૂર્વ મંજુરી સ્થિવાય મહેનતાણાના દરોમાં કોઈ વધારો કરવાનો રહેશે નહીં.

૩૦. આઉટ સોર્સથી સેવા મેળવવાની હોય તો તેના માટે નિયમિત જગ્યા અંગેની કોઈ શરતો લાગુ પડશે નહિં.

૩૧. આઉટ સોર્સ જો કોઈ કેન્દ્ર સહાયિત યોજના હેઠળ લેવાની થતી હોય તો તે અંગેનો ખર્ચ જે તે યોજના હેઠળ મેળવીને જ કરવાનો રહેશે. રાજ્ય સરકારના ફંડમાંથી ખર્ચ ઉધારવાનો રહેશે નહિં.

સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ-નિયમો તથા યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતો તેમજ આ છરાવની શરતોનું ચૂસ્તપણે પાલન થાય તે નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરીએ સુનિશ્ચિત કરવાનું રહેશે.

માંગણી કમાંક- ૮૨(કેન્દ્ર પુરસ્કૃત ૫૦%)

મુખ્ય સદર- ૨૨૩૫ સામાજિક સુરક્ષા અને કલ્યાણ

પેટા મુખ્ય સદર- ૦૨ સમાજ કલ્યાણ

ગૌણ સદર- ૧૦૨ બાળ કલ્યાણ

પેટા સદર- ૦૮ એસ.એસ.કબત્યુ-૪

માંગણી કમાંક- ૮૨(રાજ્ય પુરસ્કૃત ૪૦%)

મુખ્ય સદર- ૨૨૩૫ સામાજિક સુરક્ષા અને કલ્યાણ

પેટા મુખ્ય સદર- ૦૨ સમાજ કલ્યાણ

ગૌણ સદર- ૧૦૨ બાળ કલ્યાણ

પેટા સદર- ૧૦ એસ.એસ.કબત્યુ-૪

આ છરાવ આ વિભાગની સરખા કમાંકની ફાઇલ પર નાણા વિભાગની નોંધથી મળેલ સંમતિ અન્યથે બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાત્રશ્રીના હુકમથી અને તેમના નામે,



eSign

Signed by: DRASHTI PANKAJBHAI SHAH  
Organization Unit: Social Justice and Empowerment Department  
Organization Name: GOVERNMENT OF GUJARAT  
Date: 07-Jun-2024 (11:37 AM)

(ક્રિએટિવ શાહ)

સેક્રશન અધિકારી,  
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ.

પ્રતિ,

- માન.મંત્રીશ્રી(સા.ન્યા.)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- માન.રા.ક.મંત્રીશ્રી(સા.ન્યા.)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર
- અધિક મુખ્ય સચિવશ્રી(સા.ન્યા.)ના રહસ્ય સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- અધિક મુખ્ય સચિવશ્રી, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- અગ્ર સચિવશ્રી(આ.બા.), નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- સચિવશ્રી(ખર્ચ), નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- નાણા સલાહકારશ્રી, નાણા વિભાગ(સા.ન્યા.), સચિવાલય, ગાંધીનગર
- નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતુ, જ્લોક નં ૧૬, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- પગાર અને હિસાબી અધિકારીશ્રી અમદાવાદ/ ગાંધીનગર.
- નિવાસી ઓડીટ અધિકારીશ્રી, ગાંધીનગર.
- એકાઉન્ટન્ટ જનરલશ્રી અમદાવાદ/રાજકોટ.
- સેક્રશન અધિકારીશ્રી, ૪-૧ શાખા- બજેટ શાખા તથા કોમ્પ્યુટર સેલ(વિભાગની વેબસાઇટમાં છ શાખાના છરાવોની યાદીમાં સમાવિષ્ટ કરવાની વિનંતી સાથે)
- સિલેક્ટ ફાઈલ.

